

Water restrictions do's and don'ts	પાણી સંબંધિત પ્રતિબંધો શું કરવું અને શું ન કરવું
The following is not allowed under the current Stage 4 water restrictions:	હાલમાં ચાલી રહેલાં પાણી સંબંધિત પ્રતિબંધોના તબક્કા 4 માં નીચે દર્શાવેલ બાબતો અંગે મંજૂરી નથી:
All outdoor water use is temporarily banned.	પાણીના તમામ પ્રકારના બહાર કરવામાં આવતા ઉપયોગો પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ લાદવામાં આવેલ છે.
At this time don't:	આ સમયે આટલું કરશો નહીં:
<ul style="list-style-type: none"> Water lawns, gardens, flowers, trees and shrubs with City water 	<ul style="list-style-type: none"> હરિયાળી પરિસર, બગીચા, ફૂલો, વૃક્ષો અને થડ વિનાના ઝાડવાંને શહેરના પાણીનો ઉપયોગ કરીને પાણી પિવડાવવું
<ul style="list-style-type: none"> Fill outdoor pools or hot tubs 	<ul style="list-style-type: none"> બહાર આવેલા પૂલ અથવા હોટ ટબને ભરવું
<ul style="list-style-type: none"> Wash outdoor surfaces, including: <ul style="list-style-type: none"> Windows Exterior building surfaces Sidewalks, driveways or walkways 	<ul style="list-style-type: none"> અહીં જે આપેલી છે તેના સહિતની બહારની સપાટીઓને ધોવી: <ul style="list-style-type: none"> બારીઓ ઇમારતની બહારની સપાટીઓ ફૂટપાથ, વાહન ચલાવવાના માર્ગો અથવા પગદંડીઓ
<ul style="list-style-type: none"> Fill fountains or decorative water features 	<ul style="list-style-type: none"> ફુવારા અથવા પાણી દ્વારા સુશોભિત કરતી સુવિધાઓને ભરવી
<ul style="list-style-type: none"> Wash your car in the driveway or street 	<ul style="list-style-type: none"> તમારી મોટરને વાહન ચલાવવાના માર્ગ પર અથવા શેરીમાં ધોવી
<ul style="list-style-type: none"> Use water for construction purposes such as grading, compaction or dust control 	<ul style="list-style-type: none"> શ્રેણીકરણ, સઘનતા અથવા ધૂળના નિયંત્રણ જેવા બાંધકામ સંબંધિત કાર્યો માટે પાણીનો ઉપયોગ
Thank you for your patience and cooperation during this time.	આ સમયમાં શાંતિ જાળવવા માટે અને સહકાર આપવા બદલ તમારો આભાર!
Want to do more?	શું વધુ કરવા ઇચ્છો છો?
Reducing indoor water and non-essential use will help our water treatment plants, rivers and reservoirs catch up with demand.	ઘરની અંદર પાણીના ઉપયોગને અને બિન-આવશ્યક ઉપયોગને ઘટાડવાથી આપણા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નદીઓ અને જળાશયોને માંગ પૂરી કરવામાં સહાય મળી રહેશે.
Do You can help reduce your indoor water use by:	તમે આટલું કરીને ઘરની અંદર પાણીના ઉપયોગને ઘટાડવામાં મદદ કરી શકો છો:

<ul style="list-style-type: none"> Using the dishwasher and washing machine only when required and with full loads 	<ul style="list-style-type: none"> જ્યારે જરૂર હોય ત્યારે જ અને સંપૂર્ણ લોડ સાથે જ ડીશવોશર અને વોશિંગ મશીનનો ઉપયોગ કરીને
<ul style="list-style-type: none"> Turning off humidifiers, ice machines and automatic sprinkler systems 	<ul style="list-style-type: none"> ભેજપ્રેરક, બરફના યંત્રો અને સ્વ-ચાલિત પાણીનો છંટકાવ કરતી સિસ્ટમને બંધ કરીને
<ul style="list-style-type: none"> Scraping your plate clean rather than rinsing off food 	<ul style="list-style-type: none"> ખોરાકને ઘોઈ નાંખવાને બદલે તમારી પ્લેટને સાફ કરો
<ul style="list-style-type: none"> Washing vegetables and fruit in a partially filled sink or pot and then rinse them quickly 	<ul style="list-style-type: none"> શાકભાજી અને ફળોને એક આંશિક રીતે ભરેલી ગેંડી અથવા વાસણમાં રાખી લીધાં બાદ તેને ઝડપથી ધોવા
<ul style="list-style-type: none"> Keeping a job of drinking water in your fridge. Don't run the tap to get ice-cold water 	<ul style="list-style-type: none"> તમારા ફ્રિજમાં પીવાનું પાણી ભરીને રાખો. બરફથી ઠંડુ કરેલું પાણી પીવા માટે નળ ચાલુ કરશો નહીં
<ul style="list-style-type: none"> Turning off the tap when brushing teeth or shaving 	<ul style="list-style-type: none"> જ્યારે બ્રશથી દાંત સાફ કરતા હોવ અથવા દાઢી કરતા હોવ ત્યારે નળ બંધ કરવા
<ul style="list-style-type: none"> Limiting showers to three minutes or less and keeping baths shallow if you're able to do so (e.g., people with mobility challenges). 	<ul style="list-style-type: none"> તમારા ફૂવારા નીચે સ્નાન કરવાને ત્રણ મિનિટ અથવા તેનાથી ઓછા સમય માટે મર્યાદિત કરો અને જો તમે કરી શકો તેમ હોવ તો ઓછા પાણીથી સ્નાન કરો (દા.ત. હલન-ચલન સંબંધિત પડકાર ધરાવનાર લોકો).